



Dear Parents,

Everyone wants the best for their kids. They are our future; a future that we hope will be brighter and better. We feel so down when something bad happens to our loved ones. We will do anything to make them feel special and comfortable. But what about the people who for one reason or another don't have warmth of home and do not have the privilege of being taken care of by a family and must live on the streets or slums.

Winter is here and it can be very harsh. Lucky ones like us can have luxury of getting under our blankets and feel warm and comfortable, but many homeless suffer and sometimes die during winter. There are people sleeping on the road sides or under the bridge. Unfortunately there will be many people who will find it hard to provide themselves or their family the required comfort and warmth.

Our goal is to help as many people as possible. **Giving blankets, warm clothes and warm shawls** is a great way to help them. For us it is not a big thing, but it will be a big thing for all the poor people who can't afford it. Visma family is seeking your support to bring some winter warmth to so many people. **You can pack your donations and give it in Vrajbhoomi bus or can send it to our transport office in School.**

Regards

Students of Std. 9th Std

- **Note:** We will accept donations in plastic bags also, **but we will appreciate if you can give it in a paper or cloth bag.**



વહાલા આત્મીય સ્વજનો.....!!!

કેમ છો?

ઠંડીની મજા માણતા હશો નહીં!!!?

પણ, આ ગુલાબી મોસમમાં આવતા અનેક વિચારોમાં એક એવો હુંફાળો વિચાર પણ આવી જાય છે, કે ઠંડીથી બચવાની વાત તો દૂર, શરીર ઢાંકવા પણ જેની પાસે પુરતા કપડા નથી તેઓ અત્યારે શું કરતા હશે?

ઘરમાં હૂંફ મેળવીને બેઠેલા આપણને રસ્તાની એક બાજુમાં ટુટીયું વાળીને પડી રહેલા એ માણસોનો વિચાર આવે છે કે નહિ ? અને નથી આવતો તો કેમ?

સ્વેટર, ટોપી ને હાથમોજાં પહેરીને ફરતા આપણા બાળકની સામે ઠંડીમાં એક કપડું પહેરીને લાકડાના કે ઘાસના સહારે બનાવેલ ઘરમાં રહેતા એ છોકરાઓ પણ કોઈના હૃદયનાં તારલા તો છે જ ને ? અને જો તેને પણ આવી હૂંફ મળે તો એનાથી રૂંડું શું?

સમાજ સેવાની વાતો કે કાર્યોની સરાહના કરવાની જગ્યાએ કદાચ આવી કોઈ વ્યક્તિને ખરેખર જરૂરિયાત ના સમયે મદદ કરી શકીએ તેનું નામ જ “સેવા”.

વ્રજભૂમિ શાળા આ વર્ષે ફૂટપાથપર, રેલ્વેસ્ટેશન કે બસ સ્ટેશન અને ઝુંપડપટ્ટીમાં રૂબરૂ જઈ દરેક જરૂરિયાતવાળી વ્યક્તિઓને ગરમ કપડા, સ્વેટર, શાલ જેવી અનેક વસ્તુઓ આપવાનો સંકલ્પ કર્યો છે.

જો આપના ઘરે પણ આવા જૂના ઉપયોગમાં લીધેલા કે ન લીધેલા ગરમ કપડા, સ્વેટર, રજાઈ, શાલ વગેરે હોય તો આપ પણ તે આપી આ સત્કાર્યમાં જોડાઈ શકો છો.

આપના આપેલા કપડા કે સ્વેટર પહેરીને ફરતા એ બાળકને જોઈ કદાચ એની ગરીબ માતાના ચહેરા પર જે હાશ અનુભવાશે તે કદાચ આપે કોઈને આપેલી જીવનની સર્વોત્તમ ભેટ હશે.....

આપના સ્નેહાધીન

ઘોરણ-૯ ના વિદ્યાર્થીઓ

- **નોંધ:** અમે પ્લાસ્ટીક બેગમાં પણ દાન સ્વીકારીએ છીએ. પરંતુ જો આપ આપનું દાન પેપર / કાપડની બેગમાં આપશો તો બિરદાવીશું.